#### 13-08-2024 Tuesday

### **FREE PRESS GUJARAT**

#### **Software Roles Soar Amidst Growing Demand for Tech Talent** Ahmedabad, According to startup ecosystem also plays a

data from Indeed, the global significant role, as new matching and hiring platform, IT hiring is set to surge with an estimated 8.5% increase in the next year. After a slow period late last year and early this year, the demand for skilled IT talent is growing, making it crucial for businesses to plan their hiring strategies for the coming year. Almost 70% of all tech jobs on Indeed are currently software roles. The dominance of software roles on Indeed is bv several driven interconnected factors. As businesses increasingly depend on software for operational efficiency and innovation, the demand for developers to create and maintain essential systems has surged. Rapid advancements in technologies like AI, machine learning, and blockchain have further amplified the need for specialized development to stay competitive. The thriving tech technological roles." (1-7)

ventures prioritize hiring developers to build and scale their products. Lastly, the continuous need for updates, security patches, and new features in existing software ensures a steady demand for skilled professionals who can keep pace with evolving user needs and technological advancements. Sashi Kumar, Head of Sales, Indeed India said, "The IT sector has consistently stood as a major employment powerhouse. However, recent quarters saw a slowdown in hiring, with companies exercising caution as they navigated through global uncertainties and economic shifts. Now, the tide is turning. Companies are actively ramping up their hiring efforts. We can also expect Global Capability Centers (GCCs) to significantly software contribute to this uptick in hiring, particularly in software and

### **INDIANS' INTEREST IN DIGITAL GOLD: NAVI SURVEY**

customers to invest in a conducted by Navi among investors and non-investors of digital gold sheds light on the main reasons for its adoption in India and some barriers that prevent wider adoption of digital gold. Top reasons driving digital gold investment from the study done by Navi are as follows: 1. Gold = Good returns - 50% invested apps offering digital gold.\*

Ahmedabad, Digital gold is because gold has delivered a unique offering that allows good returns in the recent past. 2. Digital gold = No risk traditional asset class in a of theft- 39% feel digital gold modern and innovative is less risky than keeping format. A recent study physical gold at home- no worry of theft. 3. Satisfaction of buying the purest form of gold- 36% have invested in 'Digital Gold' due to its purity aspect i.e. ability to buy 24carat pure gold. 4. Digital gold is more convenient- 25% like the convenience of buying, selling, and tracking digital gold investment anytime via



**ITC HOTELS EXPAND** 

rise as the brand signs a

Ahmedabad, ITC Hotels shrines and picturesque growth trajectory continues to locations. For many, it is the ideal weekend retreat. From Welcomhotel property with boating, camel safaris, SRK Hospitality Pvt. Ltd. in spiritual sojourns, picnics & Pushkar. Expected to open in camping to partaking of the 2026, it will be spread across local flavours and legendary nearly 3 acres and shall be fairs, Pushkar has been one

**Apsara Ice Creams to launch Muskaan** initiative on its 53rd anniversary society and also celebrate

CRIOITOF

(CAR)

inception.

our 53rd anniversary. The launch will take place on August 15th, on the 78th Independence Day, which is a matter of great pride for all of us. We are really excited and thrilled to see the smiles on their faces and make their day a memorable one. We truly believe in giving back to society and adding happiness to their Ahmedabad, In a bid to lives." As part of its 53rd

bring joy and smiles to anniversary, Apsara Ice Creams will launch a unique people's faces, Apsara Ice Creams today announced initiative to celebrate India's the launch of a unique 78th Independence Day, initiative titled Muskaan on which is indeed a matter of its 53rd Anniversary on the great pride for all the Indians. occasion of the 78th The initiative will be launched Independence Day. Apsara on August 15th in Mumbai and Ice Creams is an established Pune, and will be carried out and trusted brand with a in the other cities in a phased presence in the market for manner. Under the initiative of more than five decades and Muskaan, the company has been providing premium intends to distribute 53,000 quality ice creams to their (ice cream), which is close to customers since its four tonnes of ice cream. This initiative will cover 9 states and

Speaking on the 25 cities in India. The ice occasion, Mr. Nemchand creams would be distributed Shah, Founder Partner, amongst various NGOs', Apsara Ice Creams said, orphanages, old age homes, and various foundations in The main aim of Muskaan is to bring about joy among government and nonthe various sections of government sectors. (19-10)

### Automation Expo 2024: South Asia's largest expo on automation



Ahmedabad, Automation automation to the next level, Expois India's Biggest Exhibition advancing for the Automation Industry maintenance, reducing material unveiled its 17th International waste, and enhancing demand Exhibition & Conference. This forecasting. This year's expo landmark event will be held will offer MSME sector visitors from August 21 - 24 at the a comprehensive overview of Bombay Exhibition Center the latest technologies and (BEC), Nesco, Mumbai. This solutions, featuring both expo marks a significant innovative startups and milestone, showcasing the established industry leaders. rapid growth and innovation India's industrial automation within India's automation sector is on a growth trajectory, industry. Automation Expo 2024 with the market projected to will spotlight the transformative surge from over \$15 billion to influence of Artificial Intelligence \$29.5 billion by 2029. (AI) and Robotics on process Automation Expo 2024 is and factory automation. strategically timed to capitalize Traditional robots have long on this expansion, offering a been prized for their costplatform for industry efficiency and programmability. stakeholders to explore the However, the integration of AI latest advancements and with production data now takes business opportunities. (1-7)

Ujjivan Small Finance Bank launches

# Quit smoking at first, it is not impossible to stop but go on puffing, day bigger warning can create an vehicle injuries, suicides, and



Vinod Chandrashekhar Dixit Free-lance Journalist, Writer & Cartoonist

(dixitpatrakar@yahoo.in)

Everyone is aware that "Smoking" has been criticized as the most lethal weapon of self murder. According to the Tobacco Products Act, 2004, direct and indirect advertising of all tobacco products and its sale to minors is banned. Addiction to nicotine makes it hard to quit. The increasing incidence of heart attack in India, fast spreading among younger generation has been largely on account of smoking habits. The problem of Smoking in India is widespread but no studies have been done to estimate what percentage of

the population are smokers. Roadside paan shops bountifully stocked with cigarettes feed smokers continuing to exhale smoke from cigarettes. It is a fact that smoking is a hard habit to break because tobacco contains nicotine, which is highly addictive. Smoking harms not just the smoker, but also family members, coworkers, and others who breathe the smoker's cigarette smoke, called secondhand smoke or passive smoke. In fact, statistics tell us that approximately 70 out of 100 people who smoke want

# A ince of rains

long traffic jam was created today (August 9) due to a pothole on the Jambuwa Bridge road on the Ahmedabad-Mumbai National Highway passing near Vadodara city. This type of traffic jam is happening every morning and evening for the last four days, due to which motorists are troubled. Along with this, the people of the surrounding society are also suffering a lot in commuting due to traffic. People are getting angry due to the traffic problem which is a daily headache. Every monsoon, a similar situation occurs on the National Highway near Vadodara, causing a five kilometer long traffic jam in the morning, leaving a large number of motorists stuck. People were stuck for hours due to traffic jams from Jambuwa Bridge to Kapurai Bridge. Here every time in monsoon motorists are troubled and get stuck in traffic jams. People are leaving because some are going to the hospital and some have important work to do, but due to the traffic jam, no one can reach on time. People Agency, the new sonic identity applications, ATMs and the going from Ahmedabad to Surat are facing great difficulty. People are expressing their outrage as they feel disturbed by the vehicles. Societies and schools are located right next to the Jambuwa Bridge, residents of the society said . So the residents of the societies cannot go out of the society and if they go out, they get stuck in the traffic jam. Apart from this, children are also late in reaching school. The residents of Aryan Residency near Jambuwa Bridge are very much affected by the problem of traffic jam and want the system to remove this problem by carrying out road works. Ajaybhai Panchal said that the problem of traffic jam has been there for the last four years. This problem occurs when the bridge gets potholed during monsoon. I have also written letters to the National Highway Authority in this regard and I have received a reply from the front that it is recommended to widen 4 to 5 narrow bridges from Bharuch to Vadodara.

in and day out, seemingly powerless to guit. Research has shown that non-smokers who reside with a smoker have a 24% increase in risk for developing lung cancer when compared with other nonsmokers.

Owners of sales outlets must display boards with the warnings like "tobacco causes cancer", "tobacco kills"& "sale to minors is a punishable offence". Sometimes it happens that notification prohibiting selling tobacco products to minors has no effect as the

teenagers continue to buy tobacco/cigarettes on the pretext that they are buying it on behalf of their elders. Smoking also provides other side benefits which are real. Let us remember that staying smoke free helps more of everything - more energy, better performance, better looks, more money in your pocket, and, in the long run, more life to live.

In India there is little campaigning save the statutory warnings printed in small print on cigarette cartons and advertisements.Graphic health warnings using a mixture of pictures and words are part and parcel of every country's policy on cigarette marketing. The 40 per cent warning on one side proved ineffective as vendors displayed the packaging on the other side, so that consumers would not see the warnings. Cigarette manufacturers share the kitty with vested interest, hence their interest is well protected with simple modifications to fool the general public. It is agreed that the

JHAVERI

impact when a smoker buys a cigarette pack. But how do we resolve the issue when smokers buy one or two cigarettes and the packet is being opened by the shop owner who sells cigarettes for business. It is the youth who are

the most vulnerable group as far as the consumption of tobacco is concerned. Most of them begin smoking as a fad and even as a rite of passage. According to The Cigarette Package Health Warnings: International Status Report 2014 India has slipped to 136th position in the list of 198 countries that warn smokers about the hazards of smoking through graphic pictures on cigarette packages.

Can't we implement the ban on the companies manufacturing these tobacco products of intoxication. One would find (particularly smokers) like all laws in India, nothing will be implemented. Indians just do not have the psyche to obey laws. They believe that rules are meant to be broken. Smokers are unmindful of the consequences of passive smoking. Over time, the habit of smoking weaves its way through all of the activities in our lives, and we come to think we can't be happy or productive without cigarettes.

Various provisions that we implement time and again clearly states that People can smoke on roads or in their homes but not in any other place. More deaths are caused each year by tobacco use than by all deaths from AIDS, illegal drug use, alcohol use, motor

murders combined. It smells something else

totally against enforcing the rule strongly across the country as law enacted smoking is banned only for outside propaganda. Here, the Govt. is happy that it has a law, police is happy that it can earn more money, the cigarette companies are happy that they don't have to bother, the finance ministry is happy as there is no affect on taxes and the health minister is happy that he could do atleast one thing in his tenure - so what matters if it is not implemented.

3

It is reported that a cigarette smoker shortens his life by about 5.5 minutes for each cigarette smoked, almost the time he spends for smoking it. The increasing incidence of heart attack in India, fast spreading among younger generation has been largely on account of smoking habits. Nearly 30 million people in the country are estimated to be victims of heart diseases. No doubt, the Government has come out with good points to deal with the matter but at the same time taxes on tobacco products should go up to help smokers give up. Such methods will be long lasting.

Under such circumstances, it clearly shows that the antismoking Act will go up in smoke. But I feel that People must wake up to the danger of smoke to themselves and passive smokers before it is too late. (B-15 Jyoti-Kalash Society, Jodhpur Tekra, Satellite, Ahmedabad - 380 015)

Motorists are
troubled for the last
<b>4 days</b> Vadodara, A five kilometer
Vadodara, A five kilometer

predictive

Jhaveri Credits and Capital Limited CIN: L65910GJ1993PLC020371 Regd. Office: B-2, 907-912, Palladium, B/h. Divya Bhaskar Press, Prahladnagar,

Nr. Vodafone House, Ahmedabad – 380015 Phone: +91 9712000637 | Website: www.jhavericredits.com | E-mail: csjhavericredits@gmail.com

Particulars	Quarter	Year Ended		
Particulars	30/06/2024	30/06/2023	31/03/2024	
Revenue from Operations	1224.92	9.93	2619.62	
Profit before exceptional items and tax	128.04	1.67	259.10	
Profit before tax	128.04	1.67	259.10	
Profit for the period	93.42	2.39	161.03	
Total Comprehensive Income (after tax)	93.42	2.39	161.03	
Paid up Equity Share Capital (of Rs. 10 each)	898.59	646.33	898.59	
Earnings per equity share (of Rs. 10 each)				
Basic (Not Annualised)	1.04	0.04	2.42	
Diluted (Not Annualised)	1.04	0.04	2.42	

and road. Located just 50 km for travelers. Anil Chadha, from the Kishangarh airport, Welcomhotel Pushkar will offer 96 well-appointed guestrooms, with ample the asset right strategy. We banguet facilities and various food and beverage offerings including an all-day dining restaurant, lobby lounge, a specialty restaurant and bar. Recreational spaces include a swimming pool, fitness center, leisure destinations for its spa and a kids' club. Showcasing beautiful architectural legacy, Pushkar showcase the legacy of this is much visited for its temples, charming region." (22-2)

easily accessible by air, rail of Rajasthan's star attractions offerings.

#### Lights Out three decades ago are still pertinent - Smriti Kalra Padmanabhan based the play



Ahmedabad, Making her debut in Zee TV's series '12/ 24 Karol Bagh' (2009) as Simi, actor Smriti Kalra has been a part of various TV productions, films, teleplays, and short films. She played the critically acclaimed and widely popular role of Neha in the TV show 'Itti Si Khushi' (2014) and directed the àward-winning short film Ambu (2019), in addition to woman often experiences due appearing in various films. Her acting prowess and popularity made her perfectly cries of a woman, she wants suited for a pivotal part in Zee her husband Bhaskar to Theatre's teleplay 'Lights Out'. intervene who dismisses her Renowned playwright Manjula concerns." (19-10)

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editior : Mayur C. Bhatt

Chief Executive, ITC Hotels stated, "The Welcomhotel brand continues to grow under recently opened the 25th Welcomhotel in Belagavi (Belgaum) Karnataka last month. Pushkar, located close to Aimer and Jaipur, is one of Rajasthan's most visited versatile Welcomhotel Pushkar shall

on a horrific crime that

unfolded in Mumbai's

Santacruz in 1982. When it

it created a sensation due to

its provocative subject matter.

Discussing the intense teleplay

version directed by Ritesh

Menon, Smriti says, "Lights

Out' addresses both literal and

metaphorical darkness in our

society. The overlooked

assault on a woman in the

story reflects the apathy of the

privileged and the absence of

humanity within our social

structures. The issues that

were raised three decades

ago in 'Lights Out' are still

particularly about her

character's dilemma, Smriti

says, "Leela symbolises the

inertia and helplessness a

to her social conditioning.

When she hears the desperate

Speaking

pertinent."

premiered on stage in 1986,

# its Sonic Identity: The Sound of Ujjivan

Ahmedabad, Ujjivan Small emotionally with the Finance Bank (Ujjivan SFB) a bank.Unmute has used the leading small finance bank, 'Geneva Emotional Music proudly announces the launch Scale' - a model designed to of its sonic brand identity, describe how humans respond emotionally to music. named 'The Sound of Ujjivan'. The sonic identity aims to When adapting this method to strengthen the connect with the Ujjivan brand, a list of the customers through the descriptors were defined and strategic use of sound. At the used as a common "language" heart of sonic identity is the throughout the creation Bank's sonic logo, crafted to process. As music is very capture the fundamental subjective, it's important to values like Opportunity and find ways to evaluate the Freedom which seamlessly sound from the brand's resonates with what Ujjivan perspective. The new sonic stands for - Trust and identity will be integrated Progress. Conceptualised and across various customer created by Unmute, a leading touchpoints including phone Scandinavian Sonic Branding banking, mobile banking

### **Axita Cotton Limited Recommends** bonus issue in the ratio of 1:3

profit of Rs. 3.54 crore whereas profit before tax was at Rs. 4.96 crore for the 01FY25. For the first quarter for financial year 2025, the company's total income stands at Rs. 154.96 crore and EBIDTA at Rs. 5.73 crore. Commenting on the company performance during the period, Mr. Nitinbhai Patel, Chairman and Managing Director, Axita Cotton Ltd said

"We are happy to announce strong quarterly results despite challenging industry scenario and global yarns in India, has sluggishness. The central government is making all possible efforts towards gaining access to the new markets. Indian Textile industry is one of the key industries of the country and the government through its policies and initiatives continues to give further push to the industry so that it become global ended on 30 June, 2024. The competitive and increase its company has reported a net global share." (18-2)

The Audit Committee has reveiwed the above results and the Board of Directors has approved the above results at their

respective meetings held on August 12, 2024. The above is an extract of the detailed format of the unaudited financial results for the quarter ended on June 30, 2024 filed with the Stock Exchange pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regula tions, 2015.

The full format of the Unaudited financial results for the quarter ended on June 30, 2024 are available on the Stock Exchange's website (www.bseindia.com) and the Company's website www.jhavericredits.com.

For Jhaveri Credits and Capital Limited

Place: Ahmedabad Date: August 12, 2024

Place: Ahmedabad

Date: 12.08.2024

Sd/ Vishnukumar Patel **Managing Director** 

### LESHA INDUSTRIES LIMITED

CIN- L27100GJ1992PLC018607

Regd. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Mithakhali, Ahmedabad – 380006, Gujarat, India Phone No.: 079 26463227, E-mail ID: caf.lesha@gmail.com, Website: www.lesha.in

> NOTICE OF 32nd ANNUAL GENERAL MEETING, **E-VOTING INFORMATION AND BOOK CLOSURE DATES**

NOTICE is hereby given that the 32nd Annual General Meeting (AGM) of the members of the Company will be held on Thursday, 5th September, 2024 at 3:30 p.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means "OAVM") to transact the businesses as set out in the notice of AGM in compliance with General Circular Nos. 14/2020 (dated 8th April, 2020), 17/2020 (dated 13th April, 2020), 20/2020 (dated 5th May, 2020), General Circular No. 3/2022 (dated 5th May 2022) and General Circular No. 9/2023 (dated 25th September, 2023) respectively, issued by the Ministry of Corporate Affairs ("MCA Circular(s)") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, SEBI/HO/CFD/CMD2/ CIR/P/2022/62 dated 13th May, 2022, SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January, 2023 and SEBI/HO/CFD/CFD/ PoD-2/P/CIR/2023/167 dated 7th October, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular") and al other relevant circulars issued from time to time.

Pursuant to Provision of Section 91 of the Companies Act, 2013 and as per provisions of Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the register of members and Share Transfer books of the company shall remain closed from Saturday, 31st August, 2024 to Thursday, 5th September, 2024 (Both days inclusive).

In compliance with MCA Circulars and SEBI Circular, the Notice of AGM along with the Annual Report for the financial year 2023-24 have been sent in electronic mode only to all those members whose e-mail Ids are registered with the Company or the egistrar and Share Transfer Agent or their respective Depository Participant(s). **REMOTE E-VOTING:** 

n compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members, the facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means on all the businesses set forth in the Notice of the AGM through the emote e-Voting Services provided by CDSL. The detailed instructions for remote e-voting facility are contained in the Notice of the AGM which has been sent to the Members.

he details pursuant to the provisions of Companies Act, 2013 and Rules are given hereunder:

- Cut-off date for the purpose of remote e-voting is Friday, 30th August, 2024.
- Period of e-voting: E-voting shall commence from 9:00 a.m. on Monday, 2nd September, 2024 and ends at 5:00 p.m. on Wednesday, 4th September, 2024. Please note that remote e-voting will not be allowed beyond the above mentioned time and date.
- Persons who have acquired shares and become member of the Company after dispatch of Notice of the AGM and holding shares as on the cut-off date i.e. Friday, 30th August, 2024, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of AGM.
- A person, whose name appears in the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories as on cut-off date only, shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. However, if the person is already registered with CDSL for remote e-voting, then the existing User ID and Password can be used for casting votes.
- Members attending AGM through VC/OAVM facility, who have not casted their votes by remote e-voting shall be able to cast their votes through e-voting during the AGM.
- Members who have casted their votes by remote e-voting, may also attend the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again during the AGM.
- The procedure for e-voting, attending the AGM through VC/OAVM facility and registration of E-mail ID by shareholders has been provided in the Notice of AGM. The same is available on the website of the Company: www.lesha.in, website of Central Depository Services Limited at www.evotingindia.com and at the website of BSE Limited: www.bseindia.com. In case of any query regarding attending AGM and e-voting from the CDSL e-Voting System, members/beneficial owners can contact to helpdesk.evoting@cdslindia.com or contact at Toll Free no. 1800225533.

For, Lesha Industries Limited By order of Board SD/ Leena A. Shal Managing Director DIN: 02629934

helps the customers connect website. (20-4)

Ahmedabad, Axita Cotton Ltd. one of the leading manufacturers of exporters of international quality cotton bales, cotton seeds and cotton

recommended issuance of bonus equity shares in the ratio of 1:3 (i.e., 1 bonus equity share of Re. 1 each for every 3 fully paid-up equity shares as on record date) subject to the approvals from the shareholders. Company also declared a financial results for the first quarter



# તંત્રીશ્રીની કલમે 'લોકશાહી મૂલ્યો પર વચગાળાની સરકારની રચના થવી જોઈએ'

મિલરે કહ્યું કે અમેરિકા દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમે લોકોને હિંસાનો અંત લાવવા અને સ્થિતિને સામાન્ય બનાવવાની અપીલ કરીએ છીએ. તેમણે કહ્યું, 'વચગાળાની સરકારને લગતા તમામ નિર્ણયો લોકતાંત્રિક સિદ્ધાંતો, કાયદાના શાસન અને બાંગ્લાદેશી લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ.' બાંગ્લાદેશની સ્થિતિ પર અમેરિકાનં કહેવું છે કે ત્યાંની વચગાળાની સરકાર લોકતાંત્રિક સિદ્ધાંતો, કાયદાના શાસન અને ત્યાંની જનતાની ઈચ્છા અનુસાર રચવી જોઈએ. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે મીડિયાને કહ્યું, 'અમે લોકો બાંગ્લાદેશની સરકારનું ભવિષ્ય નક્કી કરે તે જોવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે ઘણા દિવસોના હિંસક વિરોધ બાદ શેખ હસીનાએ સોમવારે રાજીનામું આપી દીધું હતું અને દેશ પણ છોડી દીધો હતો.મિલરે કહ્યું કે અમેરિકા દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમે લોકોને હિંસાનો અંત લાવવા અને સ્થિતિને સામાન્ય બનાવવાની અપીલ કરીએ છીએ, તેમણે કહ્યું કે, 'વચગાળાની સરકારને લગતા તમામ નિર્ણયો લોકતાંત્રિક સિદ્ધાંતો. કાયદાના શાસન અને બાંગ્લાદેશી લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ.' ભૂતપૂર્વ વડા પ્રધાન હસીનાએ અમેરિકામાં આશ્રય માગ્યો હતો કે નહીં તેની તેમને જાણ નહોતી.''છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયેલી હિંસા અને હત્યાઓ માટે જવાબદારી હોવી જોઈએ,'' મિલરે કહ્યું. મિલરે કહ્યું કે અમેરિકા બાંગ્લાદેશની સ્થિતિ પર કાળજીપૂર્વક નજર રાખી રહ્યું છે. અમે તમામ પક્ષોને વધુ હિંસાથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં ઘણા લોકોના જીવ ગયા છે અને અમે આગામી દિવસોમાં શાંતિ અને સંયમ રાખવા વિનંતી કરીએ છીએ. આ પહેલા વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.તમને જેણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે તમ્રાપલટ થઈ ગઈ છે અને વડાપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પણ દેશ છોડી દીધો હતો અને હાલ ભારતમાં છે. તેમની બહેન શેખ રેહાના પણ તેમની સાથે છે. તે જ સમયે. સેનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા ચાલી રહી હતી, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ સોમવારે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ અને લોકો પીએમના આવાસ તરફ આગળ વધ્યા, ત્યારબાદ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો.

# અમદાવાદ મ્યુનિ. આ નવા કીમિયાથી રૂપિયા ૧૦૦૦ કરોડ ઊભા કરશે

પોલ્યુશનવાળું શહેર બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – પમ્પિંગ (AMC) ગ્રીન ગોલ્ડમાઇનને સ્ક્રીમ્સમાં પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે अनलॉं र डरवा माटे तैयार छे. आरक्षित (AMC) टाઉन प्लानिंग (TP) આરક્ષિત અંડરયુટિલાઈઝુડ ફ્લોર સ્પેસ વેચવા માટે તૈયાર છે.આ TDR ઈન્ડેક્સ (FSI)ની હરાજી કરવા અને વેચાણમાંથી થતી આવક – AMCના FSI ने ट्रान्सइरेબલ ડेवલ૫मेन्ट અंદાજ મુજબ વાર્ષિક 3. 9,000 વેચવા માટે તૈયાર છે.અમદાવાદને આબોહવા અનુકુલન ધિરાશ ઝીરો પોલ્યુશનવાળું શહેર બનાવવા ભંડોળમાં મોકલવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ટાઉન પ્લાનિંગ (TP) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંડરયુટિલાઈઝુડ ફ્લોર સ્પેસ ન કરવાની વિનંતી કરતાં, વિચારણા ઈન્ડેક્સ (FSI)ની હરાજી કરવા અને સ્કીમ્સમાં પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે FSIને ટ્રાન્સફરેબલ ડેવલ૫મેન્ટ અધિકારીએ એ પણ જાહેર કર્યું કે એક प्લोटमांथी राઈट्स (TDR) तरीडे બિલ्ડरोने રાઈટ્સ (TDR) તરીકે બિલ્ડરોને કરોડની નજીક – એક સમર્પિત AMCની સ્ટેન્ડિંગ કમિટીના નિયંત્રણના પગલાં જેવા મહત્ત્વપૂર્ણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બિનઉપયોગી FSI, જે TDR तरीકે

અમદાવાદ, અમદાવાદને ઝીરો અનલોંક કરવા માટે તૈયાર છે. AMCના આરક્ષિત પ્લોટની હશે જેમ બાંધકામની પરવાનગી છે. તેથી, રિહેબિલિટેશન પ્રોજેક્ટ્સમાં થાય છે. સ્ટેશન, પાણીની ટાંકીઓ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP). AMCના પ્લોટમાંથી એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર બાંધવા અથવા તેમની બાંધકામ હેઠળની નવી નીતિની પષ્ટિ કરી. અલગ કમિટી ટીડીઆરના મુલ્યાંકન અને હરાજીની દેખરેખ કરશે, જેનું નેતત્વ મ્યનિસિપલ કમિશનર કરશે. કમિટીમાં Audaના CEO અને શહેરી વન વિકાસ અને વાયુ પ્રદુષણ ચેરમેનનો સમાવેશ થશેTDRનો ખ્યાલ FSI સાથે ગાઢ રીતે જોડાયેલો છે. "FSI નક્કી કરે છે કે આપેલ TDR જેવા સમાન TDR લાવ્યા છે (AMC) ગ્રીન ગોલ્ડમાઇનને વેચવામાં આવશે. તે TP સ્ક્રીમમાં જમીનના પ્લોટ પર કેટલા – જેનો ઉપયોગ ઇન-સીટુ સ્લમ

નવી આબોહવા અનુકૂલન ભંડોળ नीति अनुसार, विंडासडर्ताओं તેમની ઇમારતો પર વધારાના માળ મર્યાદા ચોક્કસ ૨કમથી વધ કરવા માટે AMCનો TDR ખરીદી શકે છે. ''એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. AMCને વિશ્વાસ છે કે વાર્ષિક રૂ. ૧,૦૦૦ કરોડનો પ્રવાહ તળાવના કાયાકલ્પ, પ્રોજેક્ટ માટે ભંડોળ પુરું પાડવા માટે निभित्त अनशे. अगाउ, AMC ओ

સંરક્ષણ પ્રોજેક્ટસમાં જોડવાનો છે." બીજી તરફ હેરિટેજ TDR, અધિકારીએ જણાવ્યું હતું. ઐતિહાસિક મિલકતોના માલિકોને स्यित नेट-ઝीरो इंरुस, देशमां

વિકાસની ખોવાયેલી સંભવિતતા માટે તેના પ્રકારની પ્રથમ પહેલ છે, જે વર્ષ વળતર આપે છે. "બિલ્ડરો TDRજ ૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરો સિટી માટે પ્રીમિયમ ચુકવે છે. ઝુંપડપટ્ટીના બનાવવાની દિશામાં કેન્દ્રિય હશે, TDR*ના કિસ્સામાં,* AMCએ રિયલ એમ તેમણે ઉમેર્યું હતું. આ એસ્ટેટ ઉદ્યોગને 3. १.७०० કરોડના બિનઉપયોગી સંભવિતતાનં TDR જનું વેચાણ કર્યું હતું. નાગરિક મુદ્રીકરણ કરીને, AMC માત્ર આવક મેળવવા અને આવકને પર્યાવરણીય પણ શ્રેષ્ઠ બનાવી રહી છે.

2

એક્સિસ બેંક લિમિટેડ (CIN: L65110GJ1993PLC020769) **કોર્પોરેટ ઓફિસ ખાતે સ્ટ્રક્ચર્ડ એસેટ્સ ગ્રૂપ,** 7 માળ, "એક્સિસ હાઉસ", સી-2, વાડિયા ઇ-સેન્ટર, પાંડુરંગ બુદ્ધકર માર્ગ, વરલી, મુંબઇ - 400025. www.axisbank.com

# પઝેશન નોટિસ (સ્થાવર મિલકત માટે) બજવણી) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૧) સાથે વાંચવામાં આવતી પરિશિષ્ટ IV મુજબ

[સુરક્ષા હિત (અ જ્યારે, નીચે સહી એક્સિસ બેંક લિમિટેડના અધિકૃત અધિકારી હોવાને કારણે, સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ ના પ૪) હેઠળ અને સંરક્ષા હિત (અમલીકરણ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વાંચવામાં આવતી કલમ ૧૩(૧૨) હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને **૩૧.૦૫.૨૦૨૩** ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરી હતી ઋણલેનાર / ગેરેન્ટર પી કે ટ્રાન્સમિશન પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, પ્રવીણ કિશોરકુમાર જૈન, પ્રભા પ્રવિણભાઈ જૈન, વિશાલ પ્રવિણભાઈ જૈન, હર્ષ પ્રવિણકુમાર જૈન અને શીતલ હર્ષકુમાર જૈન, નોટિસમાં ઉલ્લેખિત રકમ રૂ. ૭,૧૯,૮૪,૧૬૪.૦૭/- (રૂપિયા સાત કરોડ ઓગણીસ લાખ ચોર્યાસી હજાર એકસો ચોસઠ અને પૈસા સાત પુરા) ૩૦.૦૪.૨૦૨૩ ના રોજ બાકી નીકળતી રકમની ચુકવણીની તારીખ સુધીના કરારના દરે ૦૧.૦૫.૨૦૨૩ થી વધુ વ્યાજ સાથે ચૂકવવાની બાકી રકમની ચુકવણીની તારીખ સુધી; ઉપરોક્ત નોટિસની તારીખથી ૬૦ દિવસની અંદર

અહીં જણાવેલ ગીરવે મુકેલી મિલકતનો ભૌતિક કબજો માનનીય કોર્ટ કમિશનર દ્વારા તા.૧૧-૦૮-૨૦૨૪ના રોજ માનનીય અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલ આદેશ અનુસાર, સરફેસી કાયદાની કલમ ૧૪ હેઠળ દાખલ કરવામાં આવેલ અરજી અન્વયે એટલે કે, ૨૦૨૩ના ૨૦૨૩ના સીઆરએમએ નં.૧૪૧૩૮ હેઠળ દાખલ કરવામાં આવેલ અરજી અન્વયે અને ત્યારબાદ નીચે જણાવેલ ગીરવે મુકેલી મિલકતનો ભૌતિક કબજો તે જ દિવસે એટલે કે તા.૧૧/૦૮/૨૦૨૪ ના રોજ માનનીય કોર્ટ કમિશનર દ્વારા એક્સિસ બેંક લિમિટેડના અધિકૃત અધિકારીને આપવામાં આવે છે.

ખાસ કરીને ઉપર જણાવેલ ઋણધારકો/ગેરેન્ટર/મોર્ગેજરને અને સામાન્ય રીતે લોકોને આ સાથે ચેતવણી આપવામાં આવે છે કે તેઓ વિષય મિલકત સાથે વ્યવહાર ન કરે અને ઉપરોક્ત મિલકતો સાથેના કોઈ પણ સોદાને એક્સિસ બેંક લિમિટેડના ચાર્જને આધિન રહેશે, જેમાં પી કે ટ્રાન્સમિશન પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ માટે રૂ. ૭,૧૯,૮૪,૧૬૪.૦૭/- (રૂપિયા સાત કરોડ ઓગણીસ લાખ ચોર્યાસી હજાર એકેસો ચોસઠ અને પૈસા સાત **પુરા) ૩૦-૦૪-૨૦૨૩** ના રોજ બાકી નીકળતી રકમ તા. ૧-૦૪-૨૦૨૩ થી વધુ વ્યાજ, ખૂર્ચ વગેરે સાથે. ઋણલેનાર/ગેરેન્ટર્સ/મોર્ગેજરનું ધ્યાન સુરક્ષિત અસ્ક્યામતોને રિડીમ કરવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં

કાયદાની કલમ 13ની પેટા કલમ (8)ની જોંગવાઈ પર આમંત્રિત કરવામાં આવે છે. સ્થાવર મિલકતોનું વર્ણન

૧. શ્રી પ્રવિણ કિશોરકુમાર જૈન ની તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત ની **દુકાન નં.૧**, ૨૩૨ ચોરસ સ. ગ્રાપ્રાવેશ કર્યા હુમાર જે ગા પંચાય બાબ બના હરસા રાય માં સ્વાયર મહાડા માં **હુકાન મે. રે**, ૨૩૨ વાસ્ત કૂટ, ગ્રાઉન્ડ ફ્લોર, મેઝેનીન ફ્લોર સાથે ૪૦૫ ચોરસ ફૂટની આસપાસ, "એકતા કોમ્પ્લેક્સ" તરીકે ઓળખાતી ચોજના, શહેર સર્વે નં. ૪૬૨૬, મૌજે ખાતે આવેલું શ્રેયશ ઓનર્સ એસોસિયેશન : કાલુપુર-૧, તાલુકો : અમદાવાદ જિલ્લાનું શહેર ૨. શ્રી પ્રવિણ કિશોરકુમાર જૈન ની તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત ની **દુકાન નં.૭**, ૪૮ સ્કવેર

ે ઝામવેલા અહેવા છે. કીટ અને શોપ નં ટામાં પણ સ્કવેર ફીટ, ગ્રાઉલ્ડ ફ્લોર, તેમજ મેઝેનીન લ્લોર ૪૦૫ સ્કવેર ફીટની સુવિધા ધરાવતી સ્કીમ ,'એકતા કોમ્પ્લેક્ષ' તરીકે ઓળખાતી સ્કીમ, શ્રેયશ ઓનર્સ એસોસિએશન, શહેર સર્વે નં.૪૬૨૬, મૌજે: કાલુપુર-૧, તાલુકોઃ અમદાવાદ જિલ્લાનું શહેર ૩. શ્રી પ્રવિણ કિશોરકુમાર જૈન ની તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત **શોપ સેલર, મેઝેનાઇન** 

**ફ્લોર,** ૬૫૬ સ્ક્વેર ફીટ અને ૫૦૦ સ્ક્વેર ફીટની સુવિધા ધરાવતી સ્કીમ, "એકતા કોમ્પ્લેક્સ" તરીકે ઓળખાતી યોજના, શહેર સર્વે નં. ૪૬૨૬, મૌજે ખાતે આવેલું શ્રેયશ ઓનર્સ એસોસિયેશન, મૌજે: કાલુપુર- ૧, તાલુકો: અમદાવાદ જિલ્લાનું શહેર ૪. શ્રીમતી પ્રભા પ્રવિણભાઈ જૈન ની તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત ની **દુકાન નં.૨૧**, ૫૭

ચારસ કુટ્ર મેઝેનાઇન ફ્લોટ "એકતા કોમ્પ્લેક્સ" તરીકે ઓળખાતી યોજના, શહેર સર્વે નં, ૪૬૨૬, મીજે ખાતે આવેલું શ્રેયશ ઓનર્સ એસોસિયેશન, મૌજે: કાલુપુર- ૧, તાલુકો : અમદાવાદ જિલ્લાનું શહેર તારીખ: ૧૧/૦૮/૨૦૨૪

## અધિકૃત અધિકારી એક્સિસ બેંક લિ.

#### આઈડીએફ્સી ફર્સ્ટ બેંક લિમીટેડ CIN: L65110TN2014PLC097792

**280. 34161016** 

IDFC FIRST

ામ. ૧૦૩૧/૧૫/૨૦૧૧/૨૦૦૩//૩૮ રજીસ્ટર્ડ ઓફિસ : કે.આર.એમ. ટાવર્સ, સાતમો માળ, હેરીગ્ટન રોડ, ચેટપેટ, ચેજ્ઞઈ-૬૦૦૦૩૧, ટેલિફોન : +૯૧ ૪૪ ૪૫૬૪૪૦૦૦, ફેક્સ : +૯૧ ૪૪ ૪૫૬૪૪૦૨૨ અધિકૃત અધિકારી : શ્રી હિમાંશુ સિંઘ, સંપર્ક નં. ૯**ક૨૧૧**૦૦૦૫૫ અધિકૃત અધિકારી : શ્રી ચિંમચ આચાર્ચ, સંપર્ક નં. ૯૫૦૪૪૪૮૮૪૪

#### બાનગી દ્રારા સરફેસી એક્ટર-૨૦૦૨ ની જોગવાઈ<u>ઓ હેઠળ</u> વેચાણ માટે<u>ની મિલક્</u>ટ

આથી, આઈડીએફસી ફર્સ્ટ બેંક લિમીટેડ ના અધિકૃત અધિકારી દ્રારા સિકયોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટકશન ઓફ ફાયનાન્સિયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (સરફેસી એકટ - ૨૦૦૨) હેઠળ મિલકતનો <u>મિલકત નં. ૧ :-</u> દુકાન નં. ૩૧૦, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૦, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧પ.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ષ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૬-સી-ડી-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપરા, સીટી - સરત, ચતઃસીમા :- પર્વે : દકાન નં, ૩૦૯, પશ્ચિમે : દકાન નં,

# હવે ગુજરાતમાં બનશે સિંહ અને દીપડાના સફારી પાર્ક

સરકારની દરખાસ્તને ઝ ઓથોરીટી

ગાંધીનગર. ગજરાતમાં વિકસાવાશે. રાજયના વન કરી હતી. સફારી પાર્કમાં કોઈ એક કચ્છના કચ્છના સફેદ રણ તથા દીવના વિભાગનાં જ પ્રિન્સીપાલ ચીફ જ પ્રજાતિનાં વન્ય પ્રાણી રાખવાની દરીયા કિનારાના પ્રવાસે જતા લોકો કન્ઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવે હવે જંગલ સફારી પણ માણી શકશે. જણાવ્યુ હતું કે, રાજય સરકારની આમ ગુજરાતના પ્રવાસના દરખાસ્તને સેન્ટ્રલ ઝૂઓથોરીટીએ આકર્ષણના ભાથામાં વધુ એક છોગું મંજૂરી આપી દીધી છે.જંગલની ઉમેરાયં છે. ગજરાતમાં પ્રવાસનને જમીન પર અભ્યારણ ઉભા કરવાના વેગ આપવા માટે સિંહ-દીપડાના હોવાથી હવે સુપ્રીમ કોર્ટમાં દરખાસ્ત સફારી પાર્ક બનાવવાની રાજય કરાશે. સર્વોચ્ચ અદાલતે અગાઉ જંગલની જમીનમાં ઝ કે સકારી પાર્ક

નીતિથી આગળ વધીને વધુ પ્રજાતિનાં વન્યપ્રાણી રાખવાનો નિર્ણય લીધો હતો જેના કારણે પ્રવાસીઓ જુદા જુદા પ્રાણીને નિહાળવાનો રોમાંચ ઉઠાવી શકે. સેન્ટલ ઝ ઓથોરીટી દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિતા માટે પ્રિડીંગ સેન્ટર શરૂ કરવાની દરખાસ્તને પણ મંજરી આપી દેવામાં આવી છે. વન

અમદાવાદ, અસામાજિક હોવાની ફરિયાદ દાણીલીમડા દઇ રૂપિયા ૪૦ હજારની રોકડ. તત્વોનો અડ્ડો બની ગયેલા ગીતામંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

વિસ્તારમાં બેફામ બનેલા અને રવિવારે પરોઢે મહેસાણાના પોલીસનો ભય ન હોય એવી રીતે વિસનગર તાલકાના વાલમ ગામથી મુસાફરોને લંટી લેવાના વધતાં જતાં અમદાવાદના ઘોડાસરમાં રહેતા કિસ્સા વચ્ચે વધુ એક ચોંકાવનારો \_ પુત્રના ઘરે જઇ રહેલા કાંતિભાઇ પટેલ (ઉ.વ.૬૮) એસટી બસમાં કિસ્સો ઉમેરાયો છે. રવિવારે વહેલી ગીતામંદિર ઉતર્યા હતા. ઘોડાસર સવારે એક ઓટોરિક્ષા ચાલકે વૃદ્ધને અન્ય એક યુવકનું અપહરણ કરી રિક્ષામાં અગાઉથી એક યવક. મહિલા રૂપિયા ૩ લાખની માતબર ખંડણી સહિત ત્રણ પેસેન્જર બેઠાં હતાં. ઉતરી ગઈ હતી. એક પેસેન્જરને

ઇસનપુર જવાનું હોવાથી રિક્ષા ચંડોળા તળાવ પાસેથી લીધી હતી. એમ કહી અવાવરુ જગાએ રિક્ષા નીકળવા સચના આપી હતી. કાંતિભાઇ અને બાકીના બે મુસાફરો

મોબાઇલ ફોન લંટી લઇ ધમકી સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આપીને રવાના કરી દીધા હતા.

બેસાડી દીધો હતો. પોતાના પુત્રના ઘરે પહોંચ્યા ત્યારે સંજય પિઠડીયા (ઉ.વ.૧૮) પણ કાંતિભાઇના ઘરે પહોંચ્યો હતો. તેણે માગી આખો દિવસ ગોંધી રાખ્યો રસ્તામાં શાહઆલમ આવતાં મહિલા કાંતિભાઇને વાકેફ કર્યા કે ફેરવીને તેના પિતા પાસે રૂપિયા ૩ લાખની ખંડણી માગી હતી અને એસ્ટેટના ગેટ પાસે પંક્ચર પડ્યું છે આપો તો તમારા છોકરાને મારી ઊભી રાખી મુસાફરોને બહાર પેમેન્ટમાટે પ્રયાસ કર્યા હતા. પરંતુ શખ્સે મોબાઈલ ફોનની લૂંટ પૈસા ટ્રાન્સફર થયા ન હતા. આથી ચલાવીને રિક્ષા લઈને ફરાર થઈ આખો દિવસ અલગ અલગ ગયા હતા. આ મામલે વેપારી લવ્ય બહાર નીકળ્યા ત્યારે રિક્ષાચાલકે વિસ્તારોમાં ફેરવી મોડી રાત્રે નારોલ ગપ્તાએ દાણીલીમડા પોલીસમાં કાંતિભાઇને ચપ્પાના ત્રણ ઘા ઝીંકી સર્કલે યુવકને ઉતાર્યો હતો. આથી ફરિયાદ નોંધાવી છે

મસાકરને છરો બતાવીને રિક્ષામાં

JHAVERI Jhaveri Credits and Capital Limited CIN: L65910GJ1993PLC020371 Regd. Office: B-2, 907-912, Palladium, B/h. Divya Bhaskar Press, Prahladnagar, Nr. Vodafone House, Ahmedabad - 380015 Phone: +91 9712000637 | Website: www.jhavericredits.com | E-mail: csjhavericredits@gmail.com

Extract of Unaudited Standalone Financial Results for the quarter ended June 30, 2024 (Rs. in lakhs)

સરકારની દરખાસ્તને ઝૂ ઓથોરીટી જંગલની જમીનમાં ઝૂકે સફારી પાર્ક મેજુરી આપી દેવામાં આવી છે.				(Rs. in lakhs)		બતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા ઃ- પૂર્વે ઃ</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે ઃ દુકાન નં.	
ઓફ ઈન્ડિયાએ સ્વીકૃતિ આપી દીધી બનાવવા માટે કોર્ટની પરવાનગી વિભાગેયુદ્ધનાધોરણેપ્રોજેકટશરૂ ક		Quarte	rended	Year Ended	ચાર્ય છેલ્લા સુધ્ય ચાલે છે. આને છેલ્લા આવેવ	<i>ા</i> , દક્ષિણે : અન્યની મિલક્ત., <u>મિલક્ત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ ો મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪	
છે. હરવાફરવાના શોખીનો અને અનિવાર્ય બનાવતો આદેશ કર્યો છે. ૫૦૦ હેકટર જમીનમાં ચિંત	ti l	30/06/2024	30/06/2023	31/03/2024	અને હિસ્સા સાયન સ્ક્રે.મી. અને બિલ્ટ	ા ભિલકપતા હુકાપ પ. ઉ૧૧, તાજા માળ, કાયટ અરાયાપુ લતરૂળ ૧૨.૬૪ અપ એરીયાપું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન,	
આજીવન પ્રવાસી ગુજરાતીઓ માટે હતો. કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ બ્રીડીંગનું આ પ્રથમ સેન્ટર બનશે.	Revenue from Operations	1224.92	9.93	2619.62		ાર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી	
		128.04	1.67	259.10		ો-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી,	
		128.04	1.67	259.10	પીપરડી શેરી, સલા	બતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા ઃ- પૂર્વે ઃ</b> દુકાન નં. ૩૧૦, પશ્ચિમે ઃ દુકાન નં.	
	A	93.42	2.39	161.03		યા, દક્ષિષ્ટો : અન્યની મિલર્કેત. <u>મિલકર્ત નં. રૂં :</u> દુકાન નં. ૩૧૨, તમાંમ ભાગ ો મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪	
દરીયા કિનારાના પ્રવાસે જતા લોકો પ્રવાસનને નવુ બળ મળશે.લોકો ભારતના રાષ્ટ્રપતિ માટે અને વતી ડવિઝનલ ર			2.39			આ મહાકપતા હુકામ પ. ઉ૧૨, તાજી માળ, કાયટ અરાધામું લતરૂજા ૧૨.૨૪ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન,	
હવે જંગલ સફારી પણ માણી શકશે. સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓને મેનેજર(S&T), પશ્ચિમ રેલવે, ભાવનગર નીરં કામો માટે ઈ-ટેન્ડરો આમંત્રિત કરે છે. (1) ટે		93.42		161.03	કમલા ટેક્ષ્ટાઈલ્સ મ	ાર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી	
આમ ગુજરાતના પ્રવાસના વિહરતા નિહાળી શકશે. ઉના નંબર: 15-2024: ભાવનગર ડિવિઝન: જુનાગ	i did up Equity share cupital (of his 10 cucily	898.59	646.33	898.59		ી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી,	
આકર્ષણના ભાથામાં વધુ એક છોગું તાલુકાનું નલીયા-માંડવી દીવથી ૮ સોમનાથ સેક્શન સોમનાથ સ્ટેશન પરત્રણ વ	Earnings per equity share (of RS. 10 each)					બતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૧, પશ્ચિમે : દુકાન નં.	
ઉમેરાયું છે. ગુજરાતમાં પ્રવાસનને કીમી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સમયગાળા માટે ક્યોસનની બનાવ		1.04	0.04	2.42	ડ૧૩, <b>ઉત્તર</b> ∶ જગ્ય અને હિસ્સા સાથેની	યા, દ <b>ક્ષિણે</b> : અન્યની મિલકત. <u>મિલકત નં. ૪ :-</u> દુકાન નં. ૩૧૬, તમામ ભાગ ો મિલકનતો દુકાન નં. ૩૧૬, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪	
તે ગુરુપાયતા માટે ગિયુન્ડી પ્રયત્ના પટેલે ગુરુપાલ જ નાં ગુરૂરા ગુપાર્ટ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમનો વ્યા		1.04	0.04	2.42		આપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન,	
વાાયક જાળવણા કરાર. અદાાજત કમત					કમલા ટેક્ષ્ટાઈલ્સ મ	ાર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી	
(+000201.11) (2004.04.04.04.04.04.04.04.04.04.04.04.04.		nd the Board of Directo	rs has approved the	above results at their		ી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી,	
સરકારની દરખાસ્તને ઝૂ ઓથોરીટી સફારી પાર્ક જંગલ ખાતાની ૪૦૦- હજાર બસો સડસઠ અને અગિયાર પૈસા મ	9 2 The above is an extract of the detailed format of the una	udited financial results for	or the quarter ended o	on June 30, 2024 filed	પીપરડી શેરી, સલાવ	બતપુરા, સીટી - સુરત. <b>ચતુઃ સીમા ઃ- પૂર્વે ઃ</b> સીડી, <b>પશ્ચિમે ઃ</b> દુકાન નં. ૩૧૫, <b>ઉત્તરે</b> મન્યની મિલકત. <b>કુલ મિલકત ચતુઃ સીમા ઃ- પૂર્વે ઃ</b> પ્લોટ નં. ૨૪૭, <b>પશ્ચિમે ઃ</b> પ્લોટ	
ઓફ ઇન્ડિયાએ સ્વીકૃતિ આપી દીધી ૪૦૦ હેકટર જમીન પર બનાવવામાં બિડર્સે ફક્ત www.ireps.gov.in દ્વારા ઑનલા અરજી કરવાની રહેશે. વધુ જાણકારી માટે		ne SEBI (Listing Obligati	ons and Disclosure R	equirements) Regula-	: જગ્યા, દાક્ષણ : ગ નં. ૨૬-બી. ઉત્તરે :	પ્રત્યવા ામલકત. <b>સુલ ામલકત ચતુઃસામા</b> :- પૂર્વ : પ્લાટ વ. ૨ ૪૭, પાશ્વમ : પ્લાટ : પ્લોટ નં. ૨૦-સી-ડી-ઈ, <b>દક્ષિણે</b> : રીંગ રોડ. (મુકરર મિલકત) <b>અનુક્રમે લોન</b>	
છે. સાસણમાં દેવળીયા પાર્કના ધોરણે આવશે. રાજય સરકારે ગત માર્ચ કરીને વેબ સાઇટની www.ireps.gov	<ul> <li>tions, 2015.</li> <li>The full format of the Unaudited financial results for the given and the unautited financial results for the</li></ul>	uarter ended on June 30.	2024 are available on	the Stock Exchange's		લ્વ૩૪૬૪ અને ૧૩૯૧૩૦૫૨, મે. રૂચી ટેક્ષ, શ્રી રાકેશ બાબુલાલ જેન અને	
આ પ્રકારની સફારી કચ્છમાં નારાયણ મહિનામાં જ વન્યપ્રાણી સંક્રમણ મુલાકાત લો.ઓનલાઇન અરજી કરવાની છે					શ્રીમતી રેણુ આર જે		
સરોવર તથા ગીર સોમનાથમા ઉના યોજના હેઠળ રાજયમાં જુદા જુદા તારીખ06/09/2024ના રોજ15.00 કલાક સુધી		_			અધિકૃત અધિ	કારીને સરફેસી કાયદા હેઠળ ઉપરોક્ત ઉલ્લેખિત સુરક્ષિત મિલકતની ખરીદી માટે ૧ તરફથી અભિવ્યકિત પ્રાપ્ત કરી શકે છે. હવે અધિક્રત અધિકારી સિક્યોરીટી	
તાલુકાના નલીયા-માંડવીમાં સફારી પાર્કબનાવવાની જાહેરાત અµએ લાશક જોઃ fffacebook.com/WesternF		F	or Jhaveri Credits a	nd Capital Limited Sd/-		: તરફથા આભવ્યાકત પ્રાપ્ત કરા શક છે. હવ આવકુત આવકારા સિકવારાટા મેન્ટ) નિયમ, ૨૦૦૨ હેઠળ ના નિયમ ૮ અને ૯ ની શરતોમાં ખાનગી દ્રારા	
લાલુકાના નલાયા-માડ્યામાં સરારાયાક બનાયયાના શહેરાલ	Place: Ahmedabad		,	/ishnukumar Patel	ઉપરોકત મિલકતન	ા વેચાણની સુચના અહીં આપી રહ્યા છે. વેચાણ "જ <mark>ચાં છે તે પ્રમાણે છે" અને</mark>	
0	Date: August 12, 2024			Managing Director	"જેમ છે તે પ્રમાણે"	' જેમ વેચાણ કરવામાં આવશે.	
					મોર્ગેજરની	<u>મિલક્ત નં. ૧ :-</u> દુકાન નં. ૩૧૦, તમામ ભાગ અને હિસ્સા સાથેની	
KRIOHNA	🗍 🥼 લેશા ઈન્ડર	ລາມ ໄລມາ	31		મિલક્તનું વર્શન	મિલકનતો દુકાન નં. ૩૧૦, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪	
CAPITAL & SECURITIES LT	ા લેસા ઇન્ડર	દ્રાસ હિના	C			સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત	
REGD. OFFICE : 403, Mauryansh Elanza, Nr. Parekh Hospital, Shyamal Cross Road, Satellite, Ahmedabad - 380 015.	CIN: L271000	GJ1992PLC018607				હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ <i>૬</i> -સી-ડી-ઈ,	
		<b>`</b> • •				$  \langle c c \langle u   \langle u     c \rangle     \langle u   u   \langle u   u \rangle   \langle u   v   u   \langle u   u   \langle u   c \rangle   \langle u   \langle u   v   u \rangle   \langle u   v   v   v   v   v   v   \langle u   v   v   v   v   v   v   v   v   v  $	
Tel. : (079) 2676 8572, 2676 8573 Fax : + 91 - 79 - 2676 857, CIN: 667120GJ1994PLC023803, E-Mail: ksbspl@yahoo.in, Web Site: www.kcsl.co.ir	રજીસ્ટર્ડ ઓફીસ: ૭મે માળ, અશોકા ચેમ્બ	સ, મીઠાખળી છ રસ્તા, ર	મમદાવાદ ૩૮૦૦૦૬.			ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી મોજે - માલીની વાડી.	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON	રજીસ્ટડ આક્ષાસ: ૭મ માળ, અશોકા ચમ્બ ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca			sha.in		ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા ઃ- પૂર્વે</b> ઃ દુકાન નં.	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024 (Amount in Lakd	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca	f.lesha@gmail.com, V	Vebsite : www.les	sha.in		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા ઃ- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમ</b> ે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત.,	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024 (Amount in Lakk PARTICULARS QUARTER ENDED YEAR ENDI 30/06/2024 31/03/2024 30/06/2023 31/03/202	કોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca ૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ-વોર્ટીંગ	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા	Vebsite : www.les ની તારીખની નોટિસ			પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024 (Amount in Lake) PARTICULARS QUARTER ENDED YEAR ENDI 30/06/2024 31/03/2024 30/06/2023 31/03/202 (Unaudited) (Audited)	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ - વોર્ટીગ</b> આધી સલ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેસેના પરિષત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિષત્ર નં ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિષત્ર નં ૦૯/૨૦૨૩ તા. ૨૫	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં ૧૭/ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (એમ.સી.એ. પ	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારેપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોર્ડે ઓફ ઈન્ડિયાના		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા ઃ- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે :</b> જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lakk         PARTICULARS       QUARTER ENDED YEAR ENDI         MONTH COVERED       3       3       3       3       12         Total Income From Operating Income       8.63       11.41       8.59       39.3	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ - વો</b> ટીંગ આધી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસેના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૦૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEB	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્લિ, ૨૦૨૦, પરિષત્ર નં ૧૭/ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (એમ.સી.એ. પ કો/HO/CFD/CMD2/CIR/P/2022/62	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિયત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEBI/HO/CFD/PoD-		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે :</b> જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં.	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lake         PARTICULARS       QUARTER ENDED       YEAR ENDED         MONTH COVERED       30/06/2024       31/03/2024       30/06/2023       31/03/2024         MONTH COVERED       3       3       3       12         Total Income From Operating Income       8.63       11.41       8.59       3.31       10         Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)       (2.49)       5.92       1.31       16.33         Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)       (2.49)       5.92       1.31       16.33	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ – વો</b> ટીંગ આથી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસૅના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૧૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEB 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CFD/CFD-PoD-2	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્ટેખ્યર, ૨૦૨૩ (એમ.સી.એ. પ ષ્ર/H0/CFD/CMD2/CIR/P/2022/62 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૩ (સેબી પરિપત્ર) અ	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોડે ઓફ ઈન્ડિયાના ારિપત્ર નં SEBI/HO/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે :</b> જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ષ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૮-સી-ડી-ઈ,	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lakk         PARTICULARS         QUARTER ENDED         MONTH COVERED       3       3       3       3       3       3       10         MONTH COVERED       3 <th cols<="" td=""><td>ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ</b>-વોટીંગ આથી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસૅના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૧૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં seBi/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEI 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CFD/CFD-PoD- સમયાંતરે જારી કરવામાં આવે છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સ</td><td>f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર ન ૧૭/ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (એમ.સી.એ. પ પ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/62 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જ.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ</td><td>Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ (સેબી પરિપત્ર) અ ાર, ૨૦૨૪, ગુરૂવારના રોજ બર્ષ</td><td>, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોડે ઓફ ઈન્ડિયાના ારિપત્ર નં SEBI/HO/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો</td><td></td><td>પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે :</b> જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ષ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી,</td></th>	<td>ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ</b>-વોટીંગ આથી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસૅના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૧૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં seBi/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEI 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CFD/CFD-PoD- સમયાંતરે જારી કરવામાં આવે છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સ</td> <td>f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર ન ૧૭/ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (એમ.સી.એ. પ પ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/62 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જ.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ</td> <td>Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ (સેબી પરિપત્ર) અ ાર, ૨૦૨૪, ગુરૂવારના રોજ બર્ષ</td> <td>, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોડે ઓફ ઈન્ડિયાના ારિપત્ર નં SEBI/HO/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો</td> <td></td> <td>પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે :</b> જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ષ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી,</td>	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ</b> -વોટીંગ આથી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસૅના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૧૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં seBi/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEI 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CFD/CFD-PoD- સમયાંતરે જારી કરવામાં આવે છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સ	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર ન ૧૭/ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (એમ.સી.એ. પ પ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/62 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જ.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ (સેબી પરિપત્ર) અ ાર, ૨૦૨૪, ગુરૂવારના રોજ બર્ષ	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોડે ઓફ ઈન્ડિયાના ારિપત્ર નં SEBI/HO/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે :</b> જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ષ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી,
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lakk         PARTICULARS         QUARTER ENDED       YEAR ENDI         MONTH COVERED       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024         MONTH COVERED       3       3       12         Total Income From Operating Income       8.63       11.41       8.59       39.3         Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)       (2.49)       5.92       1.31       16.3         Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)       (2.49)       5.92       1.31       16.3         Net Profit/(Loss) for the Period (Refore Tax and After Exceptional Item)       (2.49)       5.92       1.31       16.3         Net Profit/(Loss) for the Period (Refore Tax and After Exceptional Item)       (2.49)       5.98       0.98       13.84         Total Comprehensive Income For the Period (Comprehensive Profit/(Loss) for the period (after Tax)       (2.49)       5.98       0.98       13.84         Total Comprehensive Income (After Tax)       315.84       315.84       315.84       315.84       315.84       315.84       315.84	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ – વો</b> ટીંગ આથી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસૅના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૦૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં sEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEI 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CFD/CFD-PoD-2 સમયાંતરે જારી કરવામાં આવેલ છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સ (વી.સી.) અન્ય ઓડિયો વિઝયુલ માધ્યમ (ઓ.સે.વી.એમ.) ઢારા યોજાશે, જેમા એ.જી.એમ. નોરિ	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર ન ૧૭/ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (એમ.સી.એ. પ પ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/62 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જ.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ (સેબી પરિપત્ર) અ ાર, ૨૦૨૪, ગુરૂવારના રોજ બર્ષ	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોડે ઓફ ઈન્ડિયાના ારિપત્ર નં SEBI/HO/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે :</b> જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત,, <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં.	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lake         QUARTER ENDED         YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OUARTER ENDED       YEAR ENDED         OU	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ - વો</b> ટીંગ આધી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસંના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિપત્ર નં ૦૪/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૧૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEB 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CFD/CFD-PD-2 સમયાંતરે જારી કરવામાં આવેલ છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સલ (વી.સી.) અન્ય ઓડિયો વિઝયુલ માધ્યમ (ઓ.એ.વી.એમ.) ઢારા યોજાશે, જેમા એ.જી.એમ. નોડિ	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં ૧૭/ મી સપ્ટેબ્લર, ૨૦૨૩ (એમ.સી.એ. પ શ/HO/CR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જી.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ રસમા દશોવામાં આવ્યા મુજબના બિઝન	Vebsite : www.les ની તારીખની નોટિસ ર૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૩ (સેબી પરિપત્ર) અ પર, ૨૦૨૪, ગુરૂવારના રોજ બર્પ તેસ હાથ ધરાશે.	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એક્સચેન્જ બોડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEBI/HO/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તામા ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પા૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે :</b> જગ્યા, <b>દક્ષિણે</b> : અન્યની મિલકત.	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lake         PARTICULARS         QUARTER ENDED       YEAR ENDI         MONTH COVERED       3       3       12         Total Income From Operating Income       8.63       11.41       8.59       39.3         Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)       (2.49)       5.92       1.31       16.3         Net Profit/(Loss) for the Period (Before Tax       (Comprehensive Profit/(Loss) for the Period (after Tax)       (2.49)       5.98       0.98       13.4         Tax) and Other Comprehensive Income (After Tax)       315.84       315.84       315.84       315.84       315.84         Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)       315.84       315.84       315.84       315.84         Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item       (0.08)       0.19       0.03       0.4	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬૩૨૨૭. e-mail ID : ca <b>૩૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ - વો</b> ટીંગ આધી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસંના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મે, ૨૦૨૦, પરિપત્ર નં ૦૪/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૧૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEB 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CFD/CFD-PD-2 સમયાંતરે જારી કરવામાં આવેલ છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સલ (વી.સી.) અન્ય ઓડિયો વિઝયુલ માધ્યમ (ઓ.એ.વી.એમ.) ઢારા યોજાશે, જેમા એ.જી.એમ. નોડિ	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં ૧૭/ મી સપ્ટેબ્લર, ૨૦૨૩ (એમ.સી.એ. પ શ/HO/CR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જી.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ રસમા દશોવામાં આવ્યા મુજબના બિઝન	Vebsite : www.les ની તારીખની નોટિસ ર૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૩ (સેબી પરિપત્ર) અ પર, ૨૦૨૪, ગુરૂવારના રોજ બર્પ તેસ હાથ ધરાશે.	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એક્સચેન્જ બોડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEBI/HO/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં. ૩૦૯, પશ્ચિમે : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે :</b> જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૬-સી-ડી-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે :</b> દુકાન નં.	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lake         PARTICULARS       QUARTER ENDED       YEAR ENDED         MONTH COVERED       3       3       3       3       3       10/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       31/03/2024       30/06/2023       3	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં ૧૭/ મી સપ્રેષ્યર, ૨૦૨૩ (એમ.સી.એ. શ/HO/CFD/CMD2/CIR/P/2022/62 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટ શ. (એ.જી.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ શ.સમા દશૉવામાં આવ્યા મુજબના બિઝ નટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૭મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૭મી મે, ૨૦૨૨ અને પ હાર, ૨૦૨૪, શુરૂવારના રોજ બપ સર, ૧૦૨૪, શુરૂવારના રોજ બપ સ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોર્ડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEB/H0/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા રોર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ,		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તીષ્ઠો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧પ.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૯-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, ઉત્તરે : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત. <u>મિલકત નો. ૬ા :-</u> દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lake         QUARTER ENDED         PARTICULARS         QUARTER ENDED         MONTH COVERED         State ENDED         Total Income From Operating Income         Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)         (2.49)       5.92       1.31       16.33         Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)       (2.49)       5.98       0.98         Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)       (2.49)       5.98       0.98       1.31       16.33         Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)       (2.49)       5.98       0.98       13.8         Total Comprehensive Income (After Tax)       (2.49)       5.98       0.98       13.8         Total Comprehensive Income (After Tax)       (2.49)       5.98       0.98       13.8 <th c<="" td=""><td>રોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca</td><td>f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્રેષ્યર, ૨૦૨૩ (એમ.સી.એ. પ શ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/52 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા ક્યોવામાં આવ્યા મુજબના બિઝ ન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ ા કરતી નોટિસ તથા નાશાકિય વર્ષ ૨૦</td><td>Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૭મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોટિટીઝ એન્ડ તા. ૧૭મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , શુરૂવારના રોજ બપ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ,</td><td>, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોર્ડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEB/H0/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા રોર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ,</td><td></td><td>પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨<i>દ</i>-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૨, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, ઉત્તરે : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧ પ.૭૯ સ્કે.મી., આવેભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં.</td></th>	<td>રોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca</td> <td>f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્રેષ્યર, ૨૦૨૩ (એમ.સી.એ. પ શ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/52 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા ક્યોવામાં આવ્યા મુજબના બિઝ ન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ ા કરતી નોટિસ તથા નાશાકિય વર્ષ ૨૦</td> <td>Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૭મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોટિટીઝ એન્ડ તા. ૧૭મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , શુરૂવારના રોજ બપ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ,</td> <td>, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોર્ડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEB/H0/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા રોર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ,</td> <td></td> <td>પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨<i>દ</i>-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૨, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, ઉત્તરે : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧ પ.૭૯ સ્કે.મી., આવેભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં.</td>	રોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca	f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્રેષ્યર, ૨૦૨૩ (એમ.સી.એ. પ શ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/52 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા ક્યોવામાં આવ્યા મુજબના બિઝ ન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ ા કરતી નોટિસ તથા નાશાકિય વર્ષ ૨૦	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૭મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોટિટીઝ એન્ડ તા. ૧૭મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , શુરૂવારના રોજ બપ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ,	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોર્ડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEB/H0/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા રોર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ,		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ <i>દ</i> -સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૨, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, ઉત્તરે : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧ પ.૭૯ સ્કે.મી., આવેભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં.
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lake         QUARTER ENDED         PARTICULARS         QUARTER ENDED         MONTH COVERED         S a 3 3 12         Total Income From Operating Income         8.63       11.41       8.59         Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)       (2.49)       5.92       1.31       16.3.3         Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)       (2.49)       5.92       1.31       16.3.3         Net Profit/(Loss) for the Period (Comprehensive Profit/(Loss) for the period (after Tax)       (2.49)       5.98       0.98       13.8         Tax) and Other Comprehensive Income (After Tax)       (2.49)       5.98       0.98       13.4         Paid up Equity Share Capital (Pace value Rs. 10/- Per Share(s))       315.84       315.84       315.84       315.84         Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item       (0.08)       0.19       0.03       0.4         Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item       (0.08)       (Amount in Lake <td>ફોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca</td> <td>f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્રેષ્યર, ૨૦૨૩ (એમ.સી.એ. પ શ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/52 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા ક્યોવામાં આવ્યા મુજબના બિઝ ન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ ા કરતી નોટિસ તથા નાશાકિય વર્ષ ૨૦</td> <td>Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૭મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોટિટીઝ એન્ડ તા. ૧૭મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , શુરૂવારના રોજ બપ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ,</td> <td>, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોર્ડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEB/H0/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા રોર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ,</td> <td></td> <td>પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે</b> : જગ્યા, <b>દક્ષિણે</b> : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., આવેભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ,</td>	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca	f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્રેષ્યર, ૨૦૨૩ (એમ.સી.એ. પ શ્ર/HO/CFD/CMD2/CIR/P/2022/52 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા (એ.જી.એમ.) તા. પમી સપ્ટેમ્બ મા ક્યોવામાં આવ્યા મુજબના બિઝ ન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ ા કરતી નોટિસ તથા નાશાકિય વર્ષ ૨૦	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૭મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોટિટીઝ એન્ડ તા. ૧૭મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , શુરૂવારના રોજ બપ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ,	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ બોર્ડે ઓફ ઈન્ડિયાના રિપત્ર નં SEB/H0/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા રોર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ,		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિણે : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે</b> : જગ્યા, <b>દક્ષિણે</b> : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., આવેભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ,	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lake         QUARTER ENDED         PARTICULARS         QUARTER ENDED       Year ENDI 30/06/2024       31/03/2024       30/06/2023       31/03/2024         Total Income From Operating Income       8.63       11.41       8.59       13.3         Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)       (2.49)       5.92       1.31       16.33         Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)       (2.49)       5.98       0.98       13.8         Net Profit/(Loss) for the Period After Tax       (2.49)       5.98       0.98       13.8         Net Profit/(Loss) for the Period After Tax       (2.49)       5.98       0.98       13.8       13.8       13.8         Total Comprehensive Income (After Tax)       (2.49)       5.98       0.98       13.8         Diduct Earning Per Share (EPS) in Rupees after Exceptional Item       (0.	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca 3૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ - વોટીંગ ગ આશી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોરેટ અકેસંના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૫, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૧૯/૨૦૨૩ તા. ૨૫ ૫, ૨૦૨૦, પરિપત્ર નં ૩૯૯૭/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં કલ્ટ 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં કલ્કા/HO/CFD/CD-PD-2 સમયાંતરે જારી કરવામાં આવેલ છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સલ (વી.સી.) અન્ય ઓડિયો વિઝયુલ માધ્યમ (ઓ.એ.વી.એમ.) ઢારા યોજાશે, જેમા એ.જી.એમ. નોઈ કંપની એક્ટ, ૨૦૧૬ની કલમ ૯૧ તથા સંબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમ ૨૦૨૪ થી ૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી બંધ રહેશે. (બંને દિવસો સહિત) એમ.સી.એ. પરિપત્રો તથા સંબી પરિપત્રોને ધ્યાનમાં રાખીને કંપનીની વાર્ષિક સામાન્ય સભાની જાણ ઈમેઈલ આઈડી કંપની તથા રજિસ્ટ્રાર અને શેર ટ્રા-સકર એજન્ટ તથા ડિપોઝિટરી પાર્ટિસિપ્ન્ટ સમક્ષ રીમોટ ઈ -વોટીંગ : કંપનીઝ એઝ. ર૦૧૬ની કલમ ૧૦૮, કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) અમેન્ડમેન્ટ ફ્રલ્	f.lesha@gmail.com, \ માહિતી તથા બુક બંધ થવા: ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્રેષ્યર, ૨૦૨૩ (એમ.સી.એ. પ પ્રા/HO/CFD/CMD2/CIR/P/2022/52 /P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે સામા દશોવામાં આવ્યા મુજબના બિઝન્ -૨સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ -૨સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ -૨સી નોટિસ તથા નાશાકિય વર્ષ ૨૦ નોધાયેલા છે તેમને મોકલવામાં આવ્યા ડા, ૨૦૧૫ના નિયમ ૨૦ અને સેબી (લિ	Vebsite : www.les ની તારીખની નોટિસ ૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ારિપત્રો) તથા સિક્યોસ્ટિઝિ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ (સેબી પરિપત્ર) અ ૧૨, ૨૦૨૪, ગુરૂવારના રોજ બર્પ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તશ્ ૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ, છે.	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એકસચેન્જ ભોડે ઓક ઈન્ડિયાના ારિપત્ર નં SEB/H0/CFD/PoD- ને અન્ય તમામ સંબંધિત પરિપત્રો રે ૩:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા શેર દ્રાન્સકર બુક ૩૧મી ઓગ્સ્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમથી જે સભ્યોના કર રીકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ,		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, <b>દક્ષિણે</b> : અન્યની મિલકત,, <u>મિલકત નં. ૨ :-</u> <b>દુકાન નં. ૩૧૧</b> , તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૯-સી-ડી-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૨, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે</b> : જગ્યા, <b>દક્ષિણે</b> : અન્યની મિલકત. <u>મિલકત તાં. ૩ :-</u> <b>દુકાન નં. ૩૧૨,</b> તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકન તો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., આવેભાજીત હકક સાથેની જમીન, કમલા ટેશ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૯-સી-ડી-ઈ, ક્ષેત્રફળ ૫૫૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી,	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024         (Amount in Lake         QUARTER ENDED VEAR ENDED 30/06/2024 31/03/2024 30/06/2023 31/03/2024         MONTH COVERED       3 <th colsp<="" td=""><td>રોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca</td><td>f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્ટેશ્વર, ૨૦૨૩ (એમ.સી.એ. ૫ ૭//P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જી.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ્ ટસમા દશોવામાં આવ્યા મુજબના બિઝન્ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ કરતી નોટિસ તથા નાશાક્યિ વર્ષ ૨૦ નોધાયેલા છે તેમને મોકલવામાં આવ્યા ક. ૨૦૧૫ના નિયમ ૨૦ અને સેબી (લિ ક સામાન્ય સભામાં ઈલેકટ્રોનિક માધ્ય</td><td>Vebsite : www.les ની તારીખની નોટિસ ર૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ (રિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , ગુરૂવારના રોજ બર્પ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ર૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ, છે. સ્ટીગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલો મધી મત આપી શકે તે માટે સભ્યે</td><td>, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એક્સચેન્જ ભોડે ઓક ઈન્ડિયાના ારિપત્ર નં SEB/HO/CFD/PoD- તે અન્ય તમામ સંભવિત પરિપત્રો રે ક:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા શેર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમથી જે સભ્યોના કર રીકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ને સી.ડી.અંસ ઝેલ. ના માધ્યમથી</td><td></td><td>પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત,, <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેસ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, શ્રેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસાયા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૧, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત.</td></th>	<td>રોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca</td> <td>f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્ટેશ્વર, ૨૦૨૩ (એમ.સી.એ. ૫ ૭//P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જી.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ્ ટસમા દશોવામાં આવ્યા મુજબના બિઝન્ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ કરતી નોટિસ તથા નાશાક્યિ વર્ષ ૨૦ નોધાયેલા છે તેમને મોકલવામાં આવ્યા ક. ૨૦૧૫ના નિયમ ૨૦ અને સેબી (લિ ક સામાન્ય સભામાં ઈલેકટ્રોનિક માધ્ય</td> <td>Vebsite : www.les ની તારીખની નોટિસ ર૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ (રિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , ગુરૂવારના રોજ બર્પ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ર૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ, છે. સ્ટીગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલો મધી મત આપી શકે તે માટે સભ્યે</td> <td>, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એક્સચેન્જ ભોડે ઓક ઈન્ડિયાના ારિપત્ર નં SEB/HO/CFD/PoD- તે અન્ય તમામ સંભવિત પરિપત્રો રે ક:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા શેર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમથી જે સભ્યોના કર રીકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ને સી.ડી.અંસ ઝેલ. ના માધ્યમથી</td> <td></td> <td>પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત,, <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેસ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, શ્રેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસાયા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૧, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત.</td>	રોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca	f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્ટેશ્વર, ૨૦૨૩ (એમ.સી.એ. ૫ ૭//P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જી.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ્ ટસમા દશોવામાં આવ્યા મુજબના બિઝન્ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ કરતી નોટિસ તથા નાશાક્યિ વર્ષ ૨૦ નોધાયેલા છે તેમને મોકલવામાં આવ્યા ક. ૨૦૧૫ના નિયમ ૨૦ અને સેબી (લિ ક સામાન્ય સભામાં ઈલેકટ્રોનિક માધ્ય	Vebsite : www.les ની તારીખની નોટિસ ર૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ (રિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , ગુરૂવારના રોજ બર્પ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ર૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ, છે. સ્ટીગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલો મધી મત આપી શકે તે માટે સભ્યે	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એક્સચેન્જ ભોડે ઓક ઈન્ડિયાના ારિપત્ર નં SEB/HO/CFD/PoD- તે અન્ય તમામ સંભવિત પરિપત્રો રે ક:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા શેર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમથી જે સભ્યોના કર રીકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ને સી.ડી.અંસ ઝેલ. ના માધ્યમથી		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત,, <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેસ્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨ દ-સી-ડી-ઈ, શ્રેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસાયા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૧, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત.
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024           (Amount in Lake)           QUARTER ENDED           YEAR ENDID           PARTICULARS         QUARTER ENDED           MONTH COVERED         3 <th< td=""><td>ફોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca 3૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ - વોટીંગ : આશી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોટેટ અક્ષેસંના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મ, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. પમી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૦૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં SEBI/HO/CED/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEE 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CED/CFD-PD-2 સમયાંતરે જારી કરવામાં આવેલ છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સા (વી.સી.) અન્ય ઓડિયો વિઝયુલ માધ્યમ (ઓ.સી.બોમ.) ઢારા યોજાશે, જેમા એ.જી.એમ. નોડિ કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૯૧ તથા સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમે ૨૦૨૪ થી ૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી બંધ રહેશે. (બંને દિવસો સહિત) એમ.સી.એ. પરિપત્રો તથા સેબી પરિપત્રોને ધ્યાનમાં રાખીને કંપનીની વાર્ષિક સામાન્ય સભાની જાણ ઇમેઈલ આઈડી કંપની તથા રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સકર એજન્ટ તથા ડિપોઝિટરી પાર્ટિસિપ્ન્ટ સમક્ષ રીમોટ ઈ -વોટીંગ : કંપનીઝ એટ, ર૦૧૩ની કલમ ૧૦૮, કંપનીઝ (મેનેજમેન્ટ આને એડમિનિસ્ટ્રેશન) અમેન્ડમેન્ટ ટ્રસ્</td><td>f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્ટેશ્વર, ૨૦૨૩ (એમ.સી.એ. ૫ ૭//P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જી.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ્ ટસમા દશોવામાં આવ્યા મુજબના બિઝન્ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ કરતી નોટિસ તથા નાશાક્યિ વર્ષ ૨૦ નોધાયેલા છે તેમને મોકલવામાં આવ્યા ક. ૨૦૧૫ના નિયમ ૨૦ અને સેબી (લિ ક સામાન્ય સભામાં ઈલેકટ્રોનિક માધ્ય</td><td>Vebsite : www.les ની તારીખની નોટિસ ર૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ (રિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , ગુરૂવારના રોજ બર્પ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ર૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ, છે. સ્ટીગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલો મધી મત આપી શકે તે માટે સભ્યે</td><td>, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એક્સચેન્જ ભોડે ઓક ઈન્ડિયાના ારિપત્ર નં SEB/HO/CFD/PoD- તે અન્ય તમામ સંભવિત પરિપત્રો રે ક:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા શેર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમથી જે સભ્યોના કર રીકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ને સી.ડી.અંસ ઝેલ. ના માધ્યમથી</td><td></td><td>પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તામા ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે. મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૬-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટે : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તથામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, ક્રમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૯-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃ સીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૧, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ઠો : અન્યની મિલકત. <u>મિલકત નં. ૪ :-</u> દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, <b>દ</b>બ્રિષ્ઠો : અન્યની મિલકત. <u>મિલકત નં. ૪ :-</u> દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, <b>દ</b>લિષ્ઠો : અન્યની મિલકત.</td></th<>	ફોન નં. : ૦૭૯ ૨૬૪૬ ૩૨૨૭. e-mail ID : ca 3૨મી વાર્ષિક સામાન્ય સભા ઈ - વોટીંગ : આશી સભ્યોને જણાવવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓક કોર્પોટેટ અક્ષેસંના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. મ, ૨૦૨૦, પરિપત્ર નં ૦૩/૨૦૨૦ તા. પમી મે, ૨૦૨૨ અને પરિપત્ર નં ૦૯/૨૦૨૩ તા. ૨૫ પરિપત્ર નં SEBI/HO/CED/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦, પરિપત્ર નં SEE 2/P/CIR/2023/4 તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ અને પરિપત્ર નં SEBI/HO/CED/CFD-PD-2 સમયાંતરે જારી કરવામાં આવેલ છે તેને ધ્યાનમા રાખીને કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સા (વી.સી.) અન્ય ઓડિયો વિઝયુલ માધ્યમ (ઓ.સી.બોમ.) ઢારા યોજાશે, જેમા એ.જી.એમ. નોડિ કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૯૧ તથા સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમે ૨૦૨૪ થી ૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી બંધ રહેશે. (બંને દિવસો સહિત) એમ.સી.એ. પરિપત્રો તથા સેબી પરિપત્રોને ધ્યાનમાં રાખીને કંપનીની વાર્ષિક સામાન્ય સભાની જાણ ઇમેઈલ આઈડી કંપની તથા રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સકર એજન્ટ તથા ડિપોઝિટરી પાર્ટિસિપ્ન્ટ સમક્ષ રીમોટ ઈ -વોટીંગ : કંપનીઝ એટ, ર૦૧૩ની કલમ ૧૦૮, કંપનીઝ (મેનેજમેન્ટ આને એડમિનિસ્ટ્રેશન) અમેન્ડમેન્ટ ટ્રસ્	f.lesha@gmail.com, \ માહિતી તથા ભુક બંધ થવા ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/ મી સપ્ટેશ્વર, ૨૦૨૩ (એમ.સી.એ. ૫ ૭//P/CIR/2023/167 તા. ૭મી ઑક્ટે મા (એ.જી.એમ.) તા. ૫મી સપ્ટેમ્બ્ ટસમા દશોવામાં આવ્યા મુજબના બિઝન્ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ નરસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના, રેગ્યુલેશ કરતી નોટિસ તથા નાશાક્યિ વર્ષ ૨૦ નોધાયેલા છે તેમને મોકલવામાં આવ્યા ક. ૨૦૧૫ના નિયમ ૨૦ અને સેબી (લિ ક સામાન્ય સભામાં ઈલેકટ્રોનિક માધ્ય	Vebsite : www.les ની તારીખની નોટિસ ર૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ (રિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પ બિર, ૨૦૨૪ , ગુરૂવારના રોજ બર્પ સેસ હાથ ધરાશે. શન ૪૨ અનુસાર સભ્યોનું પત્રક તથ ર૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ, છે. સ્ટીગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્કલો મધી મત આપી શકે તે માટે સભ્યે	, પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી એક્સચેન્જ ભોડે ઓક ઈન્ડિયાના ારિપત્ર નં SEB/HO/CFD/PoD- તે અન્ય તમામ સંભવિત પરિપત્રો રે ક:૩૦ વાગે વિડિયો કોન્ફરન્સ ા શેર દ્રાન્સફર બુક ૩૧મી ઓગ્સ્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમથી જે સભ્યોના કર રીકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ને સી.ડી.અંસ ઝેલ. ના માધ્યમથી		પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૦૯, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૧, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટો : અન્યની મિલકત., <u>મિલકત નં. ૨ :-</u> દુકાન નં. ૩૧૧, તામા ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૧, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે. મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, કમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૬-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃસીમા</b> :- <b>પૂર્વે</b> : દુકાન નં. ૩૧૦, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૨, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ટે : અન્યની મિલકત. <u>મિલકત નં. ૩ :-</u> દુકાન નં. ૩૧૨, તથામ ભાગ અને હિસ્સા સાથેની મિલકનતો દુકાન નં. ૩૧૨, ત્રીજો માળ, કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૨.૬૪ સ્કે.મી. અને બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૫.૭૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેની જમીન, ક્રમલા ટેક્ટાઈલ્સ માર્કેટ, જે સ્થિત સીટી સર્વે નં. ૨૮૮૫-સી-૧-૪૧-બી પૈકી, વોર્ડ નં. ૩, ખાનગી પ્લોટ નં. ૨૯-સી-ડી-ઈ, ક્ષેત્રફળ પપ૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૫૯.૮૭ સ્કે.મી., મોજે - માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સીટી - સુરત. <b>ચતુઃ સીમા :- પૂર્વે</b> : દુકાન નં. ૩૧૧, <b>પશ્ચિમે</b> : દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, દક્ષિષ્ઠો : અન્યની મિલકત. <u>મિલકત નં. ૪ :-</u> દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, <b>દ</b> બ્રિષ્ઠો : અન્યની મિલકત. <u>મિલકત નં. ૪ :-</u> દુકાન નં. ૩૧૩, <b>ઉત્તરે</b> : જગ્યા, <b>દ</b> લિષ્ઠો : અન્યની મિલકત.	
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024           (Amount in Lake PARTICULARS           QUARTER ENDED 30/06/2024         Mount in Lake 30/06/2024         Mount in Lake 30/06/2024           Month Covered         3         3         12           Total Income From Operating Income         8.63         11.41         8.59         39.3           Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)         (2.49)         5.92         1.31         16.3           Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)         (2.49)         5.92         0.38         13.84           Total Comprehensive Income (After Tax)         (2.49)         5.98         0.98         13.84           Total Comprehensive Income (After Tax)         (2.49)         5.98         0.98         13.44           Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)         315.84         315.84         315.84         315.84           Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item         (0.08)         0.19         0.03         0.4           Lextract of CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024           Lextract of CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024							

# અમદાવાદમાં રિક્ષાચાલકોના મુસાફરોને લૂંટી લેવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો

કાંતિભાઇએ દાણીલીમડા પોલીસ ઈસનપરમાં રહેતા લવ્ય ગપ્તા

જ્યારે ઘોડાસરના અન્ય યુવક શાકભાજીની દલાલીનો ધંધો કરે છે ગત ૨૯ જુલાઈના રાત્રીના સમયે તે રિક્ષામાં બેસીને જમાલપર બીજી તરફ કાંતિભાઇ શાકમાર્કેટ જવા રિક્ષામાં બેસીને નીકળ્યા હતા. રિક્ષામાં અગાઉથી ચપ્પ બતાવી રૂપિયા ૪૦ હજાર અને જવા શટલ રિક્ષામાં બેઠાં હતાં. ત્યારે રિક્ષામાં સાથે મસાફરી કરનાર એક પેસેન્જર બેઠેલો હતો. ચંડોળા બેરલ માર્કેટ પાસે પહોંચતા રિક્ષા ચાલકે દવા લેવાના બહાને રિક્ષા ઊભી રાખી હતી. રિક્ષામાંથી નીચે રિક્ષાચાલકે તેને જુદી જુદી જગાએ ઉતરીને પેસેન્જર લવ્ય ગુપ્તાને માર મારવા લાગ્યા તથા રિક્ષામાં બેઠલા બીજા પેસેન્જરે લવ્ય ગુપ્તાને છરો ત્યાં બેરલ માર્કેટની ગલીમાં અલકબા ધમકી આપી હતી કે જો પૈસા નહીં મારીને જે હોય તે આપી દેવાનું કહ્યં હતું. બાદમાં રિક્ષાચાલક અને તેની નાખીશ. તેના પિતાએ ઓનલાઇન સાથે પેસેન્જરના સ્વાંગમાં બેઠલા

BY ORDER OF THE BOARD KRISHNA CAPITAL & SECURITIES LTI

Sd/

DIN NO: 00944735

MANAGING DIRECTOR

ASHOKKUMAR BABULAL AGRAWAL સ્થળ : અમદાવાદ તારીખ : ૧૨.૦૮.૨૦૨૪

ઉધારકર્તા અને સહ - ઉધારકર્તાને આથી ડીમાન્ડ નોટીસ માં દર્શાવેલ રકમ ચુકવવ માટે સુચીત કરવામાં આવે છે એટલે કે ૧,૧૩,૮૭,૪૦૯.૪૩ (રૂા. એક કરોડ તેર લાખ સિત્યાંસી હજાર ચારસે નવ અને તેતાલીસ પૈસા પુરા), તા.૩૦.૦૮.૨૦૨૪ ના રોજ વ્યાજ અને આનુષંગિક વ્યાજ, જે નિષ્ફળ જશે તો મિલકત ખાનગી દ્રારા વેચવામાં આવશે. പ്പട്ടി/-તારીખ : ૧૩.૦૮.૨૦૨૪ અધિકૃત અધિકારી, આઈડીએફસી ફર્સ્ટ બેંક લિમીટેડ

લશા ઇન્ડસ્ટ્રાસ લિમોટડ

સહી/

સ્થળ ઃ સૂરત

લીના એ. શાહ

મેનેજીંગ ડીરેક્ટર

બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી

ડીઆઈએન : ૦૨૬૨૯૯૩૪

PLACE: AHM EDABAI DATE: 12/08/2024